



# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ.૦૧

તા. ૧૦.૦૧.૨૦૧૮

આગામી સમયમાં યોજનાર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે ભાજપાના નિરિક્ષકોએ આજથી કામગીરીનો પ્રારંભ કર્યો, ૧૦-૧૧-૧૨ જાન્યુઆરી એમ ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે

૧૪૨૩ ગ્રામ પંચાયતોને શાંતિ, એકતા અને વિકાસ માટે સમરસ કરવા ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીની અપીલ

“ચરૈવેતી-ચરૈવેતી”ના મંત્ર સાથે ભાજપાના લોકસેવા અને લોકસંપર્કના આગામી કાર્યક્રમો  
– શ્રી ભરત પંડ્યા

૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના ૫૮૬ મંડલોમાં ભાજપા યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ વંદન કાર્યક્રમ યોજાશે

સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લા/મહાનગરોમાં વિવિધ સ્થળોએ ૧૬ જાન્યુઆરી થી ૨૪ જાન્યુઆરી સુધી રક્તદાન શિબિર યોજાશે

તારીખ ૧૬, ૧૭, ૧૮ જાન્યુઆરીના રોજ “ઘર-ઘર ચલો અભિયાન” અંતર્ગત આગામી સમયમાં જ્યાં પણ ચૂંટણીઓ છે ત્યાં, જનસંપર્ક કરાશે

પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોજનાર ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત અને ૦૨ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા નિમાયેલ બેઠક દીઠ નિરિક્ષકોએ કામગીરી આજથી પ્રારંભી દીધી છે. આ નિરિક્ષકો પૈકી જિલ્લા પ્રભારીશ્રી, પ્રદેશ ઈન્ચાર્જશ્રી, સ્થાનિક સંગઠનના હોદ્દેદારશ્રી અને પ્રદેશ દ્વારા નિયુક્ત નિરિક્ષક મહિલાશ્રી એમ કુલ ચાર સભ્યો બેઠક દીઠ સેન્સ લેશે અને તેની માહિતી પ્રદેશ સંગઠનને સોંપશે. આ કામગીરી ૧૦-૧૧-૧૨ જાન્યુઆરી આમ ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આગામી સમયમાં યોજનાર ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત શાંતિ, એકતા અને વિકાસ માટે ગ્રામ પંચાયતોને સમરસ કરવા ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ અપીલ કરી છે.



# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)


Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

//૨//

શ્રી પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, “ચરૈવેતી-ચરૈવેતી”ના મંત્ર સાથે ભાજપાના લોકસેવા અને લોકસંપર્કના કાર્યક્રમો આગામી સમયમાં યોજનાર છે તે પૈકી, ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના ૫૮૬ મંડલોમાં ભાજપા યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ વંદન કાર્યક્રમ યોજાશે અને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી દિવસોમાં ચૂંટણીઓ થનાર છે તે સ્થળોએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. ૧૪મી જાન્યુઆરીના રોજ ગુજરાતભરની સેવાવસ્તીઓમાં બાળકો અને ભૂલકાઓને યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ કરાશે. સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લા/મહાનગરોમાં વિવિધ સ્થળોએ ૧૬ જાન્યુઆરી થી ૨૪ જાન્યુઆરી સુધી રક્તદાન શિબિર યોજાશે. ત્યારબાદ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સામાજિક સમરસતા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.

તારીખ ૧૪મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે ભાજપા સંગઠન દ્વારા તલના લાડુ અને ચિકકીની વહેચણી સેવાવસ્તીમાં જઈને કરવામાં આવશે. તારીખ ૧૬,૧૭,૧૮ જાન્યુઆરીના રોજ “ઘર-ઘર ચલો અભિયાન” અંતર્ગત આગામી સમયમાં જ્યાં પણ ચૂંટણીઓ છે ત્યાં, જનસંપર્ક કરાશે. તારીખ ૨૮ જાન્યુઆરીના રોજ વડાપ્રધાનશ્રીના “મન કી બાત” કાર્યક્રમનું સામુહિક રૂપે શ્રવણ કરાશે.

શ્રી પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જ પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજાને ભાજપાને સતત છઠ્ઠી વખત સેવા કરવાનો મોકો આપ્યો છે. ગુજરાતમાં ભાજપાનો જનાધાર વધ્યો છે. આવનારી આ ચૂંટણીઓમાં લગભગ ૬૦ જેટલી વિધાનસભા બેઠકો આવરી લેવામાં આવશે. આગામી યોજનાર ચૂંટણીઓમાં ભાજપા ખૂબ જ મોટી સરસાઈથી વિજય મેળવશે એવો આશાવાદ શ્રી પંડ્યાએ વ્યક્ત કર્યો હતો.

  
(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર - મીડિયા સેલ